

અરજદારની બી.એન.એસ.એસ. ની કલમ ૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ.

(૧) અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધ્વાન એ.પી.પી. શ્રી ને સાંભળ્યા. તપાસ કરનાર અમલદારશ્રીનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

(૨) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા/ક્રેડીટ કાર્ડ નં.૪૨૬૩૯૨૪૪૩૫૦ માંથી રૂ.૯૫૦૦/- ઉપડી ગયેલ હતા. જે બાબત તેઓએ ફરીયાદ નોંધાવેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ ધ્વારા સામાવાળાના

(૧) બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૨૭૧૦૧૧૦૦૧૩૬૧૪ માં તેઓના ગયેલા નાણાં પૈકી રૂ.૨૦૦૦/- (૨) બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૨૭૧૦૧૧૦૦૧૩૬૧૪ માં તેઓના ગયેલા નાણાં પૈકી રૂ.૫૦૦/- (૩) ફીનો પેમેન્ટ બેન્કના ખાતા નં.૨૩૭૦૨૦૭૦૯૬ માં તેઓના ગયેલા નાણાં પૈકી રૂ.૨૦૦૦/- બીએનએસએસની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર થયેલ નથી. તેઓને ખુબજ મોટુ આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે બીએનએસએસ ની કલમ ૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

(૩) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર નાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે તપાસ કરનાર અમલદારનાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના નાણા જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર ધ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે, આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ માં સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર નાણા જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ ના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ ૧૦૦ નંબર(હાલ ૧૯૩૦) પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ ધ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણા ગયેલ હોય તે બેંકને નાણા ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી સીઆરપીસીની કલમ ૯૧ તથા ૧૦૨ હેઠળ નોટીસ

આપવામાં આવે છે. નોટીસ આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણા ફીઝ કરવામાં આવે છે. વધુમાં જણાવેલ છે કે, હાલના અરજદાર સાથે સાચબર કાઠમનો બનાવ બનેલ જેમાં અરજદારનાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા/ક્રેડિટ કાર્ડ નં. ૪૨૬૩૯૨૪૪૩૫૦ માંથી રૂ. ૬૫૦૦/- ઉપડી ગયેલ હતા. જે બાબત અરજદારે પોતાની ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ આધારે અરજદારના ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળાનાં ખાતામાં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ. ૪૫૦૦/- બીએનએસએસ ક. ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણા પાછા મેળવવા માટે અરજદારે આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સાડું તેઓનો અભિપ્રાય માગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદારના નાણા સામાવાળાના જે ખાતામાં ગયેલ તે બેન્ક ખાતા બનાવટી હોવાનું તપાસમાં જાણવા મળેલ છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપીયા અરજદારને પરત આપવા તેઓનો અભિપ્રાય થાય છે. આમ, સદર હકીકત ધ્યાને લેતા અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાં થી નાણા ઉપડી ગયેલ હોવાનું તથા બેંકના શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર થયેલ હોવાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદીન સુધી કોઈ એક્ઝાઈમર થયેલ હોય કે હાલના કામે કોઈની આરોપીની ધરપકડ કરવામાં આવેલ હોય તેમ પણ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાની અત્રેની અદાલત સમક્ષ માગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાની માગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે. સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણા અરજદારને પરત આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણા પરત મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

(જ) આ તબક્કે સદર નાણા પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત અંગે બીએનએનએસ ની કલમ ૫૦૩ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે—

503. Procedure by police upon seizure of property.

(1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry or trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property.

(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit

and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

આમ ફોજદારી કાર્યરીતિ અધિનીયમની કલમ ૫૦૩(૧) માં જણાવ્યા મુજબ જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી ધ્વારા મિલકતની જપ્તીની જાણ મેજીસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજીસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

(૫) આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંક ખાતામા ફીઝ કરેલ હોય તેથી રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યમાં પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ ધ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ.પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુ ક મ ::-

- અરજદારની અરજી બીએનએનએસ ની કલમ ૫૦૩ અન્વયે આથી મંજૂર કરવામાં આવે છે.
- અરજદારને સદર ગુનાના કામે ફીઝ કરવામાં આવેલ રૂ.૪૫૦૦/- પુરા દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલીજ રકમના સધ્ધર જામીન સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપેથી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

શરતો :-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા અત્રેની અદાલત મા જમા કરાવવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ તાત્કાલીક પરત કરવાની રહેશે.
- (૩) અરજદારે સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહીત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.
- (૪) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

– વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન(બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારીએ તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ સંબંધીત બેન્ક ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબનાં જાત જામીન(બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા આ હુકમની જાણ કર્યેથી દિન-૭ માં તેઓની (૧) બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૨૭૧૦૧૧ ૦૦૧૩૬૧૪ માં તેઓના ગચેલા નાણાં પૈકી રૂ.૨૦૦૦/- (૨) બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૨૭૧ ૦૧૧૦૦૧૩૬૧૪ માં તેઓના ગચેલા નાણાં પૈકી રૂ.૫૦૦/- (૩) ફીનો પેમેન્ટ બેન્કના ખાતા નં. ૨૩૭૦૨૦૭૦૯૬ માં તેઓના ગચેલા નાણાં પૈકી રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૪૫૦૦/- અરજદારના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા/ક્રેડિટ કાર્ડ નં.૪૨૬૩૯૨૪૪૩૫૦ માં જમા/ટ્રાન્સફર કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા સંબંધીત પોલીસ સ્ટેશનને બીનચુક કરવી.

હુકમ આજરોજ તા.૧૨, માહે જુલાઈ, ૨૦૨૫ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી કરી જાહેર કર્યો.

અમદાવાદ.

તારીખ :- ૧૨-૦૭-૨૦૨૫

(એસ. જે. પંચાલ)

ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ,

અમદાવાદ શહેર.

યુનિક કોડ નં. જીજે૦૦૮૬૪.